



કુલારી-૨૦૨૨  
અંક - ૪૪

### સંપાદકીય બોર્ડ

- શ્રી એચ.જી. દવે
- શ્રી એસ.જે. મહેતા
- શ્રી એમ.એમ.૬૫૫૨
- શ્રી પી.ટી. પદેરીયા



### અનુકૂળિકા

- \* માધ્યમભાષાની કચ્ચાં ખરાબી હોય છે?
- \* પ્રેરણા મૂર્તિ
- \* જીવનનો સૌથી મૂલ્યવાળ ખજાનો
- \* યુવાની અને પ્રાણીયાં
- \* સ્વામી વિવેકાનંદ જ્યંતિ
  - અમૃતવયન
- \* હે પ્રભુ! તું કેટલો દ્યાળુ...
- \* ૧૮૫૭ના આપણા સ્વાતંત્ર સેનાનીઓ
- \* મહેનતની ઊંઘ
  - શાંતિની ઊંઘ
- \* શાળાની પ્રવૃત્તિઓ



**GSECL**



# અરુણાદય



કિગાઈન:- એમ.એમ.૬૫૫૨(મા.શિક્ષક) ૯૦૯૯૯૫૨૪૦૧

## તંત્રી સ્થાનેથી

સર્વે જુઅમ્ડીસી , જુઅસઈસીએલ કર્મચારી ભાઈઓ-બહેનો , શિક્ષકભિત્તો તથા વિદ્યાર્થીઓ સૌને સાદર વંદન “અરુણોદય” ફેલુઆરી - ૨૦૨૨ , અંડ-૪૪ ને આપ સર્વની સમસ રજુ કરતાં ખૂબ ખૂબ હર્ષની લાગણી અનુભવું છું.

તંત્રી સ્થાનેથી સર્વેને હું આ અરુણોદય અંકમાં આપ દ્રારા કોઈપણ લેખ આપવામાં આવશે તો તે ટ્વીકાર્ય રહેશે. જેથી આજના આ ઓનલાઇન જમાનામાં સુંદર લેખો વાંચવા માટે અને લખવા માટે કર્મચારીઓ તથા તેમના આત્મિતો પ્રેરિત થશે અને વધુમાં વધુ લેખો આપણે આ અંકમાં સમાવી શકીશું.

તંત્રી

## માણસમાં ક્યાં ખરાળી હોય છે ?



ધર્મનો નથો જ શરાબી હોય છે  
 બાકી માણસમાં ક્યાં ખરાબી હોય છે  
 ★ પડી ગયાં છે ઈશ્વરનાં અંગ પર ચાંદા  
 બાકી ધર્મની વાણી ક્યાં તેજબી હોય છે!  
 ધર્મને બચાવવા રક્ષકો જજુમે  
 શું ધર્મ એટલો તકલાદી હોય છે ?  
 નાળિયેર પોતાના ઘર તરફ ફેર્ફાર  
 ભૂવો જ બડો તકવાદી હોય છે !  
 સેવામાંથી મેવાની બૂ ખદખદે  
 કરુણાનો સાગર આભાસી હોય છે  
 પેટનો ખાડો નચાવે મજબૂરોને  
 સાંતાલકોળનું સંગીત વાસી હોય છે !  
 રઠીઓની પગમાં સાંકળ બાંધે  
 તલવાર બડી હરમજદી હોય છે  
 ભાઈ-ભાંડુઓના માથા વાઢે  
 કાહીરો પણ બડા જેહાદી હોય છે !  
 નેક-ટેક સૌ નાનાને નડતી,  
 ધર્મધુરંધરો અરછા કાળ હોય છે  
 નડો નહીં કોઈને સાહેબ તો,  
 ન હો નમાજી તોય ઈશ્વર રાજુ હોય છે  
 જુમો શરાબી જુમો બરાબર  
 નથાની લાત બડી કરારી હોય છે.  
 સત માનવતાને ઘુતમાં હારતુ  
 અસતની પાંચશેરી ભારી હોય છે !



હેમન્શિંહ સોણા  
સેક્સન ઓક્સિસર  
સાધ્યાતથ-ગાંધીનગર  
(ખૂબપૂર્વ પિથાળી)





# પ્રેરણ॥ મૂર્તિ



Chanchu Rekhaben J.  
Secondary teacher Eng.med.

આપણો ભારતદેશ જ્યારે અંગેજોની ગુલામીમાં સબડતો હતો લોકો નાહિંમત બની ગેવેલા ત્યારે એક સંન્યાસીએ દેશવાસીઓને જગ્યાત કરી, હિંમત આપી, ધોપણા કરી કે,


'હે ભારતવાસી ! રાતદિવસ પ્રાર્થના કરકે,  
હે વિભો ! હે જગદંબે ! મને મનુષ્યત્વ આપ, શૌર્ય આપ,  
હે સામર્થ્યદાયિની મા ! મારી બધી નિર્બળતાને દૂર કર,  
મારી કાયરતાનો નાશ કર ; મને સાચો માનવ બનાવ.  
આવી પ્રેરણાનું પાન કરાવનાર સંન્યાસી એ જ સ્વામી વિવેકાનંદ.

સ્વામી વિવેકાનંદનો જન્મ 12 મી જાન્યુઆરી 1863 ના રોજ થયો હતો. સ્વામી વિવેકાનંદનું જીવન, તેમના ઉચ્ચ વિચારો યુવાનો માટે હંમેશા પ્રેરણા-રૂપ રહ્યા છે અને એટલે જ સ્વામી વિવેકાનંદની જન્મજન્યાંત્રી યુવાદિન તરીકે મનાવવામાં આવે છે. તેમની માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતું અને પિતાનું નામ વિશ્વનાથ દત્ત હતું. કાશીધામમાં આવેલા બિલેશ્વર મહાદેવની બાધા અને પૂજા બાદ તેમનો જન્મ થયો હોવાથી તેમની માતાએ તેમનું નામ બિલેશ્વર રાખ્યું હતું. ઘરમાં લાડથી બધા 'બિલે' કહેતા હતા. પરંતુ કુઠુંબના રિવાજ મુજબ તેમનું નામ 'નરેન્દ્રનાથ' પાડવામાં આવ્યું. સ્વામી વિવેકાનંદ બાળપણમાં અને યુવાનીમાં પણ વિશેષ હતા પણ મને એમના બાળપણના પ્રસંગો વાંચવા બહુ ગમે. એમના બાળપણ વિશે વાંચીએ ત્યારે નજર સમક્ષ તેમનું બાળપણ, તોકાની નરેન્દ્ર જાણે જીવંત થઈ જાય. તેઓ બાળપણમાં ખૂબ જ તોકાની હતા છતાં દ્યા, કરુણા, પ્રામાણિકતા, નીડરતા અને જાણવાની જિજાશા જેવા ગુણો એમનામાં બાળપણ થી જ હતા. નરેન્દ્રના તોકાનથી હેરાન - પરેશાન થઈ તેમની માતા કહેતા - 'અરે શંકરદાદા પાસે મેં માંગ્યો હતો ડાય્યોડમરો દીકરો, પણ તેમણે તો પોતાના એક બાબરા ભૂતને જ મોકલી દીધ્યો ! એનાથી તો ભાઈ તોબા.'

નરેન્દ્ર બહુ તોકાને ચડી ધમપણાડા કરવા લાગતો ત્યારે કેટલા પણ પ્રયત્નો કરવા છતાં નરેન્દ્ર શાંત ન થાય એટલે છેવટે માતા બિલેના કાનમાં 'હરહર મહાદેવ ! હરહર મહાદેવ !' એમ બોલતા જતાને માથા પર ચારપાંચ લોટા પાણી રેડતા ત્યારે જઈ નરેન્દ્ર શાંત થતો.

બાળપણનો એક પ્રસંગ : -

બાળપણમાં તેમની માતા નરેનને રામાયણ, મહાભારત, ભાગવતની વાતો કહેતા. નરેન્દ્ર પણ ખૂબ ધ્યાન દઈને સાંભળતો. એકવાર બાળક નરેન્દ્રએ એવું સાંભળ્યું કે હનુમાનજી કેળાની વાડીમાં વસે છે. આ વાતની તેમના બાળ માનસ પર એટલી અસર થઈ કે રામકથા પૂરી થઈ એટલે નરેન સીધો કેળાની વાડીમાં



(લેખ લખનાર રેખાબેન ચાચુ  
એ દીરેલ રિત)

હનુમાનજીને શોધવા પહોંચી ગયો. ત્યાં ઘણીવાર સુધી હનુમાનજીને તેણે આમ તેમ - ચારે બાજુ શોધ્યા!!

છેવટે હનુમાનજી ન મળતા નિરાશ થઈને ઘેર પાછો ફર્યો. તેણે તેની માતાને વાત કરી એટલે આશ્વાસન આપતા માં એ કદ્યું હનુમાનજી રામચંદ્રના ભક્ત છે એટલે એમની સેવામાં ક્યાંક ગયા હશે એટલે તને કેળાની વાડીમાં ના દેખાયા. આમ કહી બાળક નરેનને માતાએ શાંત કર્યો.

સદિશ :-

સ્વામી વિવેકાનંદના સદિશ યુવાનોમાં નવી ઉર્જાનો સંચય કરે છે. નિરાશામાં આશા ભરે છે, નિર્બળને બળવાન બનાવે છે અને કાયરોને શૂરવીર બનાવે છે.

સ્વામી વિવેકાનંદ કહેતા કે જીવનમાં જે દિવસે સમસ્યા ન આવે એ દિવસે સમજીલેજો કે તમે ખોટા રસ્તે છો. કારણેકે સત્યનો માર્ગ ક્યારેય સરળ હોઈ જ ન શકે. જીવનની દરેક સમસ્યા માંથી કંઈને કંઈ શીખવાનું હોય છે. અનુભવ જ શ્રેષ્ઠ શિક્ષક છે.

તેઓ કહેતા ઉંમરથી કોઈ યુવાન નથી હોતું આપણે આપણા વિચારોથી યુવાન બનીએ છીએ જે વ્યક્તિ ભૂતકાળ વિશે વિચાર્યા કરે, ભૂતકાળમાં જ જીવે એ યુવાન હોઈ જ ન શકે. યુવાન એ છે જે આવતીકાલ માટે સપના જોવે અને એ સપનાને પૂરા કરવા દોઢ નિશ્ચય કરે.

સ્વામી વિવેકાનંદ કહેતા ‘હું બધું જ કરી શકું છુ’ એ જ સફળતાનો મૂળ મંત્ર છે. કારણેકે પોતાના વિશે જેવું વિચારશો એવા જ બની જશો. જો તમારી જાતને કમજોર સમજો છો તો કમજોર જ રહેશો અને જો મજબૂત સમજો છો તો મજબૂત બનશો.

કલકત્તામાં એક વિરાટ સભામાં સ્વામી એ લોકોને ઉપદેશ આપ્યો હતો કે ‘તમે દેશને ચાહો.. દેશના માણસોને પ્રાણથીયે વધારે ચાહો... દેશના લોકોની સેવા કરો.... જનસેવા એ જ પ્રભુસેવા.... કશાથીયે ડરો નહિ... તમે વીર છો... ખૂબ હિંમવાન બનો.’


4 જુલાઈ 1902 ના રોજ માંદગીના કારણે સ્વામી વિવેકાનંદનું મૃત્યુ થયું. માત્ર 39 વર્ષનું ઢુંકુ પણ અતિસમૃધ્ય જીવન જીવીને આપણી વર્ચ્યે હંમેશા માટે અમર થઈ ગયા.

‘વિધા ભાણવાની સાથે તમારા શરીર અને મન પણ જેના થી બળવાન બને, મનમાં બીજાનું ભલુ કરવાની ઈરછા જગે એવા પ્રયાસો કરજો’. આવી પ્રેરણાનું પાન કરાવનાર સ્વામી વિવેકાનંદ જાણે આપણને કહી રહ્યા છે.

‘ઉઠો, જગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યારહો.’



# જીવનનો સૌથી મુખ્યત્વાનું પણ જાળનો




એક વખત સમ્રાટ સિકંદર ની પાસે એના મુખ્ય સેના અધિકારી મળવા માટે આવ્યા અને પોતાની સાથે સોનાની હીરાજડિત સુંદર પેટી લાવ્યા. આ પેટી ઈરાનથી લાવવામાં આવી હતી બધા આ પેટી ને તાકી તાકી ને જોવા લાગ્યા. અત્યંત સુંદર નકશી થી પેટી શોભી રહી હતી અને એમાં પણ પેટી પર જડેલા કિંમતી રત્નો એની શોભામાં વધારો કરી રહ્યા હતા.

સિકંદર પોતે પણ આ પેટી જોઈને ખૂબ ગ્રભાવિત થયા. એમણે દરબારીઓને પૂછ્યું, "આ પેટીમાં શું રાખવું જોઈએ?" કોઈએ કહ્યું કે આપની પાસે ના અત્યંત કિંમતી હીરા જવેરાત આ પેટીમાં રાખો. કોઈએ ખજના ની ચાવીઓ આ પેટીમાં રાખવાની સલાહ આપી તો કોઈએ અંગત પત્રો આ પેટીમાં રાખવા જોઈએ એવું સૂચન કર્યું.


સમ્રાટ વિચારમાં પડી ગયા કે આ પેટીમાં એવી કઈ અમૂલ્ય ચીજ રાખી શકાય? પોતે સાવ સામાન્યમાંથી અસામાન્ય કેવી રીતે બન્યા એ બાબતમાં આંખો બંધ કરીને ઊંડાણપૂર્વક વિચારવાનું શરૂ કર્યું. જીવનમાં આગળ વધવાની પ્રેરણા કોના દ્વારા પ્રાપ્ત થઈ હતી એ બધાને યાદ કર્યા. દરબારમાં બેઠેલા બધા અધિકારીઓ સિકંદર ના ચહેરા પરના બદલાતા હાવભાવ જોઈ રહ્યા હતા. બધાને એ જાળવાની જિજ્ઞાસા હતી કે સમ્રાટ આ પેટીમાં કઈ ચીજ રાખવાનું પસંદ કરશે? સિકંદરે સસ્પિન્દ્ર ચહેરે આંખો ખોલી અને આજ્ઞા કરી, "મહાકવિ 'હોમર' નું લખેલું મહાકાવ્ય. 'ઈલીયાડ' રાખવામાં આવે. મારા માટે સૌથી મૂલ્યવાન એ પુસ્તક છે જેણે મારા જીવનને એક નવી દિશા આપી."

જીવનની સૌથી અમૂલ્ય મૂડી સારા પુસ્તકો છે જે વિપરીત પરિસ્થિતિઓ ની વચ્ચે પણ જીવનને ઉત્સવની જેમ ઊજવવાની ઉમદા પ્રેરણા પૂરી પાડે છે.





# ધૂવાળી અને પ્રાણાયામ



'હઠયોગ' નામના શાસ્ત્ર મુજબ આપના જીવનમાં કેટલા શ્વાસ લખ્યા છે તેની સંખ્યા નક્કી છે. એનો અર્થે એ થથો કે વ્યક્તિ જેટલા દીર્ઘ (લાંબા) શ્વાસ લેશે એટલું તેનું આયુષ્ય દીર્ઘ બનશે. જેમ કે શ્વાન ૧ મિનીટમાં ૮૦ થી ૧૦૦ વખત શ્વાસ લે છે. તેથી તેનું આયુષ્ય ૧૨ થી ૧૫ વર્ષનું જ છે! જ્યારે કાચબો ૧ મીનીટમાં ૨ કે ૩ વખત શ્વાસ લે છે, તો એનું આયુષ્ય ૨૦૦ થી ૨૫૦ વર્ષ સુધીનું હોય છે!

જીવન માં પાણી, ખોરાક, અને વાયુનું ખુબ જ મહત્વ છે, અને તે યોગ્ય માત્રામાં શરીરને મળવા જરૂરી છે. હવા શ્વાસ દ્વારા શરીરની અંદર જાય છે, આથી શ્વાસ લેવાની રીત મહત્વની છે, યોગસુત્રમાં તેનું વિસ્તૃત વર્ણન છે, યોગના યોગી કહે છે, કે મગજ અને શ્વાસને સીધો સબંધ છે, મગજ અલેલ (અવ્યવસ્થિત) હોય તો શ્વાસ ખલેલ થાય છે, દેનિક જીવનમાં ધાણી એવી પરિસ્થિતિ હોય છે કે જે વ્યક્તિના શ્વાસોશ્વાસના લય ને ખોર્વે છે. જેમ કે વ્યક્તિ ગુરુસામાં હોય તો તેના શ્વાસોશ્વાસની કિયા ઝડપી બને છે. વ્યક્તિ દુખી હોય તો શ્વાસ તૂટક-તૂટક ચાલે છે. જો વ્યક્તિ એકદમ ભયભીત થઈ જાય, તો શ્વાસ અટકી-અટકીને ચાલે છે. મોટે ભાગે આ બધી અવસ્થામાં આપણે ક્યારેય શ્વાસોશ્વાસની આ ગતિવિધિ અંગે નોંધ લેતા હોતા નથી. આથી આવા સમયે જો શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરી ઉંડા તેમજ લાંબા શ્વાસ લેવામાં આવે તો આ પરિસ્થિતિમાંથી જલ્દી સ્વસ્થતા પ્રાપ્ત કરી શકાય છે.

શ્વસોશ્વાસનો વ્યવસ્થિત લય સ્વસ્થ જીવન માટે ખુબ જ આવશ્યક છે, જો વ્યક્તિના જીવનમાં આ લય ખોરવાય તો તેનું શરીરતંત્ર, રઘિરાલિસરણતંત્ર અને પાચનતંત્ર અનિયમિત થઈ જાય છે. હોમોન્સનું સંતુલન ખોરવાય જાય છે અને શરીરના અંગો પર તેની અવળી અસર થાય છે, એટલું જ નહિ, વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ ધીમે-ધીમે ઓછી થતી જાય છે, અને ધીમે-ધીમે તેનું શરીર જુદાજુદા રોગોનું ધર બનવા લાગે છે. આથી રોજંદા જીવનમાં શ્વાસને નિયમિત કરવા ખુબ જરૂરી છે આ માટે નિયમિત પ્રાણાયામએ એક જ સરળ અને અસરકારક ઈલાજ છે.

પ્રાણાયામમાં બે શબ્દો સમાયેલા છે. 'પ્રાણ' અર્થાત ઉર્જા અને 'આયામ' અર્થાત શિસ્ત. પ્રાણાયામનો અર્થ એ પણ છે કે જગૃત રહી શ્વાસોશ્વાસ પર નિયંત્રણ લાવવું. સરળ શબ્દોમાં એમ કહી શકાય કે પ્રાણાયામ એટલે શ્વાસ જેંચવો અને છોડવો અથવા તેને નિયમાનુસાર સંયમિત કરવો.

પ્રાણાયામએ યોગનું ચોંચું સોપાન છે. પ્રાણાયામ થી શરીરના કોષેકોષમાં પ્રાણનો સંચય કરી નવજીવન પ્રાપ્ત કરી શકાય છે. શરીરરૂપી અબજો કોષોના આ સમુદ્રમાં દરરોજ લાખો કોષો મરે છે અને એટલાજ નવા ઉત્પન્ન થાય છે. સાધારણ રીતે વ્યક્તિ શ્વાસોશ્વાસ કરે છે ત્યારે તેના ફેફ્સાની ત્રીજા ભાગની શક્તિનો જ ઉપયોગ કરે છે પરંતુ નિયમિત પ્રાણાયામ કરવાથી ફેફ્સામાં આવેલા કરોડો જાળાઓ જગૃત થઈ લોહિને સો ટકા શુદ્ધ કરે છે, શરીર ના માંદા કોષો નવજીવન પામતા થાક અને કંટાળો દુર થાય છે. આયુષ્ય વધે છે. ઓક્સિજનને શરીરમાં ઉડે ઉડે દરેક કોષ સુધી પહોંચાડવા માટે પણ ઉંડા શ્વાસોશ્વાસ કરવા ખુબ જ જરૂરી છે.

પ્રાણાયામ એક માત્ર ઉપાય છે જેના વડે આંતર અંગો શુદ્ધ થાય છે. મારા મતે રોગોને શરીરમાં પ્રવેશતા અટકાવવા માટે પ્રાણાયામને ૧ થી ૧૦૦ નંબર આપી શકાય. કોરોના જેવી મહામારીમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે નિયમિત પ્રાણાયામ શ્રેષ્ઠ ઉપાય છે., આથી પ્રાણાયામને રોજંદી દિનચર્યાનો જ એક ભાગ બનાવી દેવો જોઈએ.



# સ્વામી વિવેકાનંદ જયંતિ

## - શાળાત્મકત્વાન



શ્રીમતી અસ્મીતાબેન એચ. ટ્રિવેદી  
પ્રાથમિક શિક્ષક

- \* એક વિચારને ગ્રહણ કરો, તેને તમારા જીવનનું સર્વસ્વ બનાવી દો, તેના વિશે ચિંતન કરો, તેના સ્વભાવ સેવો. એ વિચાર પર જ જીવો. એ સિવાયના અન્ય સર્વ વિચારોને બાજુ પર મૂકી દો. સફળતા મેળવવાનો આ એક જ માર્ગ છે.
- \* સ્વાર્થ એટલે અનીતિ, સ્વાર્થ ત્યાગ એટલે નીતિ.
- \* નિઃસ્વાર્થ વધુ લાભદાયક છે. પરંતુ તેનું આચરણ જેટલું ધૈર્ય લોકોમાં હોતું નથી.
- \* નારીઓની સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી જગતના કલ્યાણની કોઈ સંભાવના નથી. પંખી કુંઇ એક જ પાંખથી ઊડી શકે નહીં.
- \* બીજી કોઈપણ વસ્તુ કરતાં વધુ બળવાન સંકલ્પછે.
- \* જીવનમાં આવતી આદૃતો - મુશ્કેલીઓથી ડરો નહિ. હિંમતભેર આત્માના અવાજ સાથે તેમનો સામનો કરો. તમને એમાં જરૂર સફળતા મળશે.
- \* બધા જ ધર્મો સત્ય છે. કોઈનીય નિંદા કરો નહિ. ધર્મ એ માત્ર શ્રદ્ધાની વસ્તુ નથી. હા, એ તો સાક્ષાત્કારની વસ્તુ છે. અનુભૂતિની વસ્તુ છે.
- \* આત્મવિશ્વાસ ભાવિ ઉન્નતિનું પ્રથમ પગથિયું છે.
- \* દુરદ્રાઘાઓનો સાગર હુમેશાં અતૃપ્ત રહે છે. એની માગણીઓ જેમ પૂરી કરીએ તેમ તેમ એ વધુ ને વધુ ગંજે છે.
- \* જેઓ પોચા દિલના અને ડરપોક હોય છે. તેમની જીવન - નૌકા કિનારા પાસે સાગરનાં તોકાની મોઝાં ઓથી ડરીને દુબી જાય છે. પરંતુ જેઓ શૂરવીર છે તેઓ આ તોકાનો તરફ નજીર પણ નથી કરતા. વીર બનો, નિર્ભય બનો.
- \* છેલ્લે
- \* ઊઠો, જગો અને જ્યાં સુધી ધ્યેય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી કાર્યમાં લાગ્યા રહો.



# હે પ્રભુ! તું કેટલો દ્યાજુ...



કુ. એન.વી. સોરઠીયા  
અભ્યાસ.સિક્ષાક

વિશ્વની શ્રેષ્ઠ શક્તિ નો સ્ત્રોત આપણાં જીવનમાં ન ખબર પડતાં વહી રહ્યો છે. તેમને ઓળખવામાં આપણો આખો જન્મારો આમને આમ વીતતો જઈ રહ્યો છે.

સુખમાં કે દુઃખમાં જે કદી આપણો સાથ ન છોડે તેવા ઈશ્વર માટે કેટ કેટલો આભાર વક્ત કરવો એની આપણને પૂર્ણ સમજ નથી. સુખમાં માનવ ભલે ઈશ્વરને ભૂલી જાય તો વળી દુઃખમાં એ જ માનવ પાછો ઈશ્વરને દોષ પણ આપે. છતાં ઈશ્વર આપણને તરછોડતો નથી.

આપણે વ્યાખ્યારિક, સામાજિક જગતમાં જો કોઈ ના ગુનેગાર હોઈએ તો કેટલું બધું સાંભળવું પડતું હોય. ત્યારે વિચાર આવે કે આપણે સુખમાં છલકાતા હોઈએ ત્યારે તો ઈશ્વરને ભૂલી જઈએ તો તે શું આપણો મોટો ગુનો નથી?

સર્જન અને વિસર્જન એ એમની જ લીલા છે. માનવ હસતો - ખીલતો રહે એના માટે સુંદર સૂછિનું સર્જન પણ એ જ ઈશ્વર કરે છે તો વળી - ફરી નવી સૂછિ રચવા વિસર્જન પણ કરે છે.

યાંત્રિક, તાંત્રિક, મંત્રોચ્ચાર થકી ભલે માનવ મહાન બનવાની કોશિશ કરતો હોય પણ ઈશ્વર આગળ તે વામણો જ સાબિત થાય છે. કેટલીયે ચેલેન્જ ભલે માનવ કરતો હોય છતાં ઈશ્વર આગળ એનું કાંઈ ચાલતું નથી.

ઈશ્વરે મોકલેલા દુઃખમાં પણ જો હકારાત્મક રીતે વિચારીએ તો જરૂર સમજાય કે મોકલેલું દુઃખ આપણાં વિકાસ માટે જ હોય છે. કોરોના કાળમાં વિશ્વના શ્રેષ્ઠ ધનવાનો ને પણ સમજાઈ ગયું છે કે બધું હોવા છતાં ઈશ્વર સામે કોઈપણ વ્યક્તિ લાચાર જ છે.

એમ પણ માનવ પોતાના રાઈ જેવડા દુઃખને પર્વત જેવું દેખાઈને દુઃખી દુઃખી થતો હોય છે. પરંતુ ખરેખર બીજાના દુઃખનો જ્યારે વિચાર કરીએ ત્યારે આપણને આપણું દુઃખ જરૂર હળવું લાગશે.

શરીર રૂપી ભાડાના મકાનમાં રહેતો માનવ ઈશ્વરનું ઋણ કોઈપણ શરતે ચુકવી નથી શકવાનો. ખરેખર એ વિધાન સાચું જ છે કે “તું થાને ફરે છે ગુમાનમાં? તારે રહેવું ભાડાના મકાનમાં”.

બધી જ જગ્યાએ થી કદાચ માનવને હતાશા મળે પરંતુ ઈશ્વર આગળ તેનું ચોક્કસ સમાધાન થતું હોય છે. હે ઈશ્વર ! “તું અદશ્ય બની વિહરે છે મુજ ચેતન ભરી કાયા માં”. તારા ગુણગાન ગાવા માટે અમારી બુધ્ય ટૂંકી પડે. અમ માનવ જાતના દોષોને તું સદા કૃપા દેણી વરસાવી માફ કરી રહ્યો છે. તારા ઉપકાર કેવી રીતે વાળવા ? એની સમજ અમેને પ્રદાન કર એવી શુભ ભાવના....



હે પ્રભુ ! તારી કૃપાથી જ આજે અમે  
સ્વતંત્ર ભારતમાં શ્વાસ લઈ રહ્યા છે.



# જીવના આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ



મહેશ એલ. ૬૫૫૨  
આસો.  
કાંતી તીર્થ -માંડવી



**બહાદુરશાહ જફર**  
(૧૭૭૫ – ૧૮૬૨)

મુઘલ વંશના છેલ્લા બાદશાહ બહાદુરશાહ જફર સાઈ વર્ષની છેફ વયે ગાઢીનરીન થયા હતા. આ ગાળામાં જ ભારતના પ્રથમ- ૧૮૫૭ના સ્વાતંત્ર્ય યુદ્ધની શરૂઆત થઈ ચૂકી હતી તે યુદ્ધ છેડનાર સ્વાતંત્ર્યસેનાનીઓને બહાદુરશાહમાં પોતાના નેતાની છબિ દેખાઈ. પરિણામે બહાદુરશાહને તેમના સેનાપતિ બનાવી દીધા.

પરંતુ બહાદુરશાહ હિલ્ડીમાં હૂમાયુની કબરમાં સંતાયેલા હતા. ત્યાંથી તેમને પકડીને કેદ કરી લેવામાં આવ્યા. સાથે તેમના ત્રણ પુત્રો અને એક પૌત્ર પણ હતો. તે સૌને બર્મા (મ્યાનમાર) - રંગૂનમાં રાખવામાં આવ્યા હતા. કેપટન હડસને બહાદુરશાહના પુત્ર-પૌત્રના શિરરચ્છિંદ કાપીને તેને ભેટ તરીકે મોકલ્યાં હતાં.



**કુવરસિંહ**  
(૧૭૭૩ – ૧૮૫૮)

કુવરસિંહ રાજપૂત રાજ ઘરાણાનો વંશજ હતો. એંસી વર્ષની છેફ વયે તેમણે ઈસ્ટ ઇન્ડિયા કંપની સામે લડવા માટે પોતાના સૈન્યની સરદારી લીધી હતી. પૂરી શુરવીરતાથી અને જુસ્સાથી તે યુદ્ધમાં કૂઠી પણ્યો હતો. બહાદુરીપૂર્વક તેણે દુશ્મનોનો સામનો કર્યો.

ઈ. ૧૮૫૮ની છેલ્લી લડાઈમાં તેના સૈન્યે અંગ્રેજ સૈનિકોનો કચ્ચયરધાણ કાઢી નાંખ્યો હતો. આ દરમિયાન ગંગા નદી પાર કરતાં તે લાથ પર મોટો ઘા પડ્યો હતો. સ્ફેજે ગમ્ભરાયા વિના તેણે તલવારનો એક જટકો મારી પોતાનો લાથ કાપી ગંગામાં નાંખી દીધો હતો. બીજે દિવસે તેનું મૃત્યુ થયું હતું. ભારત આજાદ થયા બાદ ૧૮૬૮માં તેના માનમાં એક ટાપાલ-ટિકિટ બહાર પડી હતી. બિહારમાં તેના નામે એક યુનિવર્સિટી છે.



**તાત્યા ટોપે**  
(૧૮૧૪ – ૧૮૫૮)

કાનપુરના પેશા નાના સાહેબના અત્યંત વિશ્વાસુ સાથીદાર તાત્યા (રામચંદ્ર) ટોપે ભારતના સ્વાતંત્ર્ય-યુદ્ધના એક બહાદુર સિપાઈ હતા. તેમણે નાની ઊમરે ૧૮૫૭ના સ્વાતંત્ર્યસંગ્રહમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો હતો.

ઈ. ૧૮૫૧માં જ્યારે તેલહાઉસીએ પિતાનું પેન્શન રોકી રાખ્યું તે બદલ તાત્યા ટોપે અંગ્રેજોનો કહ્ય દુશ્મન બની ગયા. કાનપુરમાં તેમણે ફરીથી નાનાસાહેબની સત્તા સ્થાપવામાં મહત્વનો ભાગ ભજવ્યો. જ્વાલિયર અંગ્રેજોના લાથમાં પડ્યા પરી, તાત્યાએ ખાનદેશ અને રાજસ્થાનમાં ગેરિલા યુદ્ધ છેડયું હતું. કાંસીએ ચઢાવી તેમનો વધ કરવામાં આવ્યો હતો. મધ્ય પ્રદેશમાં તેમની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.





### नाना साहेब पेश्वा

(१८२४ - १८०९)

अदारसो सत्तावननी प्रथमस्वातंत्र्य कान्तिना अग्रणी आरंभक, नानासाहेबे स्वातंत्र्य-युद्धनी मशाल सળगावी. आ मशालनी ज्वाणाने तेमણे देशना अन्य भागोમां फेलावी. तेमना आ प्रदान बदल तेओ वीर पुरुष तरीके घ्यातनाम છે. तेमણे स्वयं तलवार उठावीने युद्धमां ફूही पड़या હતा.

बालराव पेश्वाना मृत्यु बाद गाडीએ आવनार तेमને अंग्रेज सરકारे तेमનુं पेन्शन નકारी કર्बन્યું હતું. કાનપુરમાં કાન્તિકારીઓની તेमણે આગેવાની લીધી હતી. કાનપુર કબજે કરીને તेमણે કાનપુરના પેશ्वा તરીકે તेमણે પોતાને જાહેર કર્યા હતા. તेओ અનેક લડાઈઓ લડયા હતા. તेमના રહસ્યમય જીવન પર સુપ્રસિદ્ધ લેખક જુલે વર્ણ સહિત અનેક લેખકોએ પુસ્તકો લખ્યા હતા.



### મंगल पांडे

(१८२७ - १८५७)

अंગ्रेज સત્તા સામે માથું ઉચ્ચકનાર સૌપ્રથમાગ જરતો ભારતીય કાંતિકારી હતો મંગલ પાંડે. १८५७માં સિપાઈઓએ કરેલા બળવાનો તે પહેલો નેતા હતો. આ બળવો આગળ જતાં ભારતના સ્વાતંત્ર્યયુદ્ધમાં ફેરવાયો. તેની જ્વાળાઓ આખા દેશમાં ફેલાઈ ગઈ.

'બંગાળ નેટિવ ઇન્ફન્ટ્રી'માં ઉઠમી રેજિમેન્ટમાં તે એક સિપાઈ હતો. જ્યારે તેને બરાકપોરમાં મૂકવામાં આવ્યો હતો ત્યારે તેણે અંગ્રેજ ઓફિસરો પર ઝૂમલો કરીને તેમની હત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. બળવાનું કારણ એ હતું કે તેઓ રાઈફલમાં જે કારતૂસ વાપરતા હતા તેમાં ગાયની ચરબીમાંથી બનાવેલા ચ્રીજ લગાડવામાં આવતું હતું. તે કારતૂસ તેમણે દાંત વડે તોડવાની હતી. તેનો વિરોધ કરવા બદલ તેને ફાંસી આપવામાં આવી.



### રાણી લક્ષ્મીભાઈ

(१८२८ - १८५८)

'ઝાંસી કી રાણી' તરીકે પ્રજામાં લોકપ્રિય એવાં રાણી લક્ષ્મીભાઈ મધ્યપ્રદેશના ઝાંસી રાજ્યના રાણી હતાં. ત્યાં મરાઠાઓનું શાસન હતું. १८५८ના સ્વાતંત્ર્યસંગ્રહમાના તે અગ્રણી નેતા હતાં. અંગ્રેજ સાઝાજ્ય સામે માથું ઉચ્ચકતા સૌથી નાની ઉમરની તે એકમાત્ર બહાદુર અને બળવાખોર સ્ત્રી હતા. જ્વાલિયરના કોટા કી સરાઈ પાસેના ફૂલબાગ વિસ્તારમાં અંગ્રેજો સાથે થયેલા ખૂંખાર યુદ્ધમાં १८મી જૂન, १८५८ના દિવસે તે મૃત્યુ પામ્યા હતાં.

રાણી લક્ષ્મીભાઈ એ ભારતની વીરાંગના તરીકે અત્યંત આદરપાત્ર છે અને સુભાપચ્ચદ બોજની 'આજાદ હિંદફોજ'ની એક રેજિમેન્ટનું નામહિં. ભારતમાં અનેક સ્થળોએ તેમની પ્રતિમા છે.



# ગાંધીજી રંધ્રે - શાંતિની રંધ્રે



પી. બી. પ્રજાપતી  
ઉચ્ચ. માધ્યમિક શિક્ષણ

ઉંઘ એ ઈશ્વરનું શ્રેષ્ઠ વરદાન છે. માણસ પાસે બધું હોય પણ ઉંઘ ન હોયનો તેની શું હાલત થાય ? ખરેખર વિચારતા કરે મૂકે એવો ગજબનો સવાલ છે. પૈસાથી બધું ખરીદી શકાય પણ ઉંઘ નહિં . ધન અને ઉંઘ ને વ્યસ્ત સંબંધ છે. જેની પાસે પુષ્કળ ધન તેની ઉંઘ ઓછી અને જેની પાસે ઓછું ધન તેની ઉંઘ શાંત વાળી ઉંઘ હોય . વળી , મહેનત કર્યા વગરના લોકોને કદી શાંતિની ઉંઘ નથી આવતી. ' નવરો માણસ નખ્ખોટ વાળે ' તે કહેવત સાચીજ છે. પછી તેને શાંતિની ઉંઘ ક્યાથી આવે ? .

એક શેઠ ને રાત્રે ઉંઘ આવતી ન હતી . આખી રાત તેઓ પડખાં ફેરવતાં . તેમની પાસે બધું હતું પરંતુ મનની શાંતિ ન હતી. એકવાર એક મહાત્મા શહેરમાં આવ્યા ત્યારે શેઠ પોતાની ચિંતા દૂર કરવા જણાવ્યું. સંત બોલ્યા , "તું દિવ્યાંગ છો એટલે તને ઉંઘ કેવી રીતે આવે ? ".



શેઠ વિચારમાં પડી ગયા હું તો તદ્દન સહી સલામત છું. મારું એકેય અંગ ખોડખાપણ વાળું નથી . સંત બોલ્યા , શેઠ તમે બધું જ એશ આરામ થી મેળવો છો. બીજાને દુભાવીને મેળવો છો. વળી , તમારું અંગ કોઈપણ જતની મહેનત વગર પાંગળું બની ગયું છે. તમે જો શારીરિક મહેનત કરો તો જ તમને શાંતિની ઉંઘ આવે. શેઠને સંતની વાત ગળે ઉત્તરી ગઈ. તેમને લાગ્યું કે મારી શાંતિની ઉંઘ માટે મારે તેમની આજ્ઞા માથે ચડાવી પુરુષાર્થ કરવો જ રહ્યો.



મહેનતના પરસેવા વગરનું ધન કદી , શાંતિની ઉંઘ ન આપી શકે.

## શાળાની પ્રવૃત્તિઓ



શાળાના શિક્ષકા બહેન રેખાબેન ચાચુ  
એ દોરેલ ચિત્ર



શાળાની વિદ્યાર્થીની દ્વારા ડેસાઇન  
એ દોરેલ ચિત્ર





શાળા કક્ષાએ ૧૫ થી ૧૮ વર્ષના બાળકો માટે સરકારની  
દ્વારા કાયિક-૧૯ રસણ માટે રસીકરણ કાર્યક્રમ



## પ્રજાસત્તાક દિનની ઉજવણી

